

Dr. Babasaheb Ambedkar Open University
Term End Examination January - 2026

Course	: Certificate Course	Date	: 08/03/2026
Subject Code	: CCCD-02	Time	: 11:30am to 01:45pm
Subject Name	: સમુદાય માટે પોષણ	Duration	: 02.15 Hours
		Max. Marks	: 100

- ભોજન અને તેને ગ્રહણ કરવું એ કેવું તાત્પર્ય છે?
(A) ધાર્મિક (B) સામાજિક (C) પોષ્ટિક (D) આર્થિક
- શારીરિક વૃદ્ધિ માટે ભોજનમાં શું હોવું જરૂરી છે?
(A) પ્રોટીન (B) ચરબી (C) કાર્બોદિત (D) વિટામિન
- નીચેનામાંથી આહારના કાર્યો પૈકી કયું સુસંગત નથી?
(A) દેહધાર્મિક કાર્ય (B) સામાજિક કાર્ય
(C) ભાવનાત્મક કાર્ય (D) મનોવૈજ્ઞાનિક કાર્ય
- સ્વાસ્થ્યનાં કેટલાં પરિમાણ છે?
(A) ચાર (B) પાંચ (C) બે (D) ત્રણ
- પોષણ અને _____ નો એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ છે.
(A) આહાર (B) સ્વાસ્થ્ય (C) ખનિજદ્રવ્યો (D) તંદુરસ્તી
- કયા પોષકઘટકોનું પ્રમાણ આહારમાં અધિક હોય છે?
(A) સૂક્ષ્મમાત્રા પોષક ઘટકો (B) અતિમાત્રા પોષક ઘટકો
(C) બૃહદ્ માત્રા પોષક ઘટકો (D) એકપણ નહિ
- લાળસથી ભરેલો આહાર અન્નનળી દ્વારા ક્યાં પ્રવેશે છે?
(A) જઠરમાં (B) નાના આંતરડામાં (C) સ્વાદુપીંડમાં (D) પિત્તાશયમાં
- ખાંડ, મધ અને ગોળમાં કેટલા પ્રતિશત કાર્બોદિત પદાર્થ રહેલો છે?
(A) 80 થી 90 પ્રતિશત (B) 90 થી 95 પ્રતિશત
(C) 95 થી 100 પ્રતિશત (D) 85 થી 90 પ્રતિશત
- ઊર્જા માપવાનો એકમ કયો છે?
(A) કેલોરી (B) કિલોગ્રામ (C) કિલો કેલરી (D) સેલ્શિયસ
- કાર્બોદિત પદાર્થોના પાચનનું મુખ્ય સ્થાન કયું છે?
(A) પિત્તાશય (B) જઠર (C) સ્વાદુપીંડ (D) નાનું આંતરડું
- પાણી એક ઉત્તમ _____ છે.
(A) દ્રાવક (B) પ્રવાહી (C) દ્રાવણ (D) સ્રોત
- એક ગ્રામ કાર્બોદિત પદાર્થ લગભગ કેટલી કિલો કેલરી પ્રદાન કરે છે?
(A) 5 કિલો કેલરી (B) 4 કિલો કેલરી (C) 8 કિલો કેલરી (D) 10 કિલો કેલરી
- પ્રોટીનને બનાવતા નાઈટ્રોજનયુક્ત મૂળ એકમને શું કહે છે?
(A) ગ્લુકોઝ (B) સેલ્યુલોઝ (C) ફોલિક એસિડ (D) એમિનો એસિડ
- કોળામાં મળતા પ્રોટીનમાં કોની માત્રા અધિક જોવા મળે છે?
(A) મિથિયોનીન (B) લાયસીન (C) એમિનો એસિડ (D) વેલિન
- લીલાં પાંદડાવાળા શાકભાજી એ કયા વિટામિનના સમૃદ્ધ સ્ત્રોતો છે?
(A) વિટામિન એ (B) વિટામિન ડી (C) વિટામિન કે (D) વિટામિન ઈ

16. થાયમિનને કયો વિટામિન કહેવામાં આવે છે?
(A) વિટામિન બી₁ (B) વિટામિન બી₂ (C) વિટામિન બી₆ (D) વિટામિન બી₁₂
17. કોણ રક્તનિર્માણમાં મહત્વપૂર્ણ કાર્ય કરે છે?
(A) પ્રોટીન (B) વિટામિન (C) કાર્બોહિડ્રેટ (D) ફોલિક એસિડ
18. મનુષ્યના શરીરમાં લગભગ કેટલા ગ્રામ કેલ્શિયમ હોય છે?
(A) 1400 ગ્રામ (B) 1200 ગ્રામ (C) 1600 ગ્રામ (D) 2000 ગ્રામ
19. આપણા ભોજનમાં કોણ સોડિયમ તથા ક્લોરાઈડનાં મુખ્ય સ્ત્રોત છે?
(A) ખાંડ (B) મીઠું (C) મસાલા (D) ફળો
20. _____ સૌથી અધિક માત્રામાં ગલગંથીમાં હોય છે.
(A) પ્રોટીન (B) વિટામિન (C) ખનિજ ક્ષાર (D) કાર્બોહિડ્રેટ
21. યકૃત કયા વિટામિનનો સારો સ્ત્રોત છે?
(A) એ (B) બી (C) ડી (D) કે
22. અનાજમાંથી માત્ર કોની અંદર કેરોટિન હોય છે?
(A) ઘઉં (B) બાજરી (C) જુવાર (D) પીળા રંગની મકાઈ
23. એક પુખ્ત વ્યક્તિના શરીરમાં લગભગ કેટલા ગ્રામ સોડિયમ મળી આવે છે?
(A) 100 ગ્રામ (B) 150 ગ્રામ (C) 120 ગ્રામ (D) 200 ગ્રામ
24. ભોજન તથા શરીરમાં ઉપસ્થિત પ્રોટીનમાં કેટલા પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે?
(A) 25 (B) 22 (C) 24 (D) 32
25. ખાંડ લગભગ 100 પ્રતિશત શું છે?
(A) વિટામિન (B) ચરબી (C) કાર્બોહિડ્રેટ પદાર્થ (D) ખનિજ ક્ષાર
26. થાયમિનની પ્રસ્તાવિત દૈનિક માત્રા કેટલા મિલીગ્રામ પ્રતિ 1000 કિલો કેલરી છે?
(A) 0.5 (B) 0.10 (C) 0.4 (D) 0.3
27. યોખા એ કયા ક્ષેત્રના આહારનો મુખ્ય હિસ્સો છે?
(A) પૂર્વ ભારત (B) પશ્ચિમ ભારત (C) ઉત્તર ભારત (D) દક્ષિણ ભારત
28. આહાર એવો હોવો જોઈએ જેનાથી _____ થાય.
(A) ભૂખની સંતૃપ્તિ (B) ભૂખની ઇચ્છા (C) ભૂખથી નિરસતા (D) એકપણ નહિ
29. કેટલા માઈક્રોગ્રામ એક મિલીગ્રામ બરાબર છે?
(A) 100 (B) 1000 (C) 10 (D) 10000
30. જેની ઉંમર 20 વર્ષ કે તેથી અધિક હોય તેને શું કહેવામાં આવે છે?
(A) કિશોર (B) પુખ્ત વ્યક્તિ (C) યુવાન (D) એકપણ નહિ
31. એક માઈક્રોગ્રામ રેટીનોલની માત્રા કેટલા માઈક્રોગ્રામ કેરોટીન બરાબર હોય છે?
(A) 5 (B) 4 (C) 3 (D) 10
32. _____ મુખ્યતઃ કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા છે.
(A) ફેફસા (B) કરોડરજ્જુ (C) હાડકાં (D) માંસપેશીઓ
33. ભારતીય સંદર્ભ મુજબ કેટલા વર્ષની આયુ વર્ગના વ્યક્તિને પુરુષ માનવામાં આવે છે?
(A) 20-39 (B) 20-35 (C) 18-35 (D) 21-39

34. એક પુખ્ત વ્યક્તિને પ્રતિ કિલોગ્રામ શરીરના વજન બરાબર કેટલા ગ્રામ પ્રોટીનની આવશ્યકતા હોય છે?
- (A) 10 ગ્રામ (B) 1 ગ્રામ (C) 15 ગ્રામ (D) 100 ગ્રામ
35. પુખ્તાવાસ્થાના સંપૂર્ણ ગાળાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યો છે?
- (A) ત્રણ (B) ચાર (C) પાંચ (D) બે
36. યુવાન વ્યક્તિની તુલનામાં વૃદ્ધ વ્યક્તિને ઊર્જાની આવશ્યકતા કેવી હોય છે?
- (A) વધુ (B) ઓછી (C) મધ્યમ (D) એકપણ નહિ
37. “પરિવારમાં ગાયનું માંસ ખાવાનો નિષેધ છે.” આ વિધાનમાં કયો પહેલુ રહેલો છે?
- (A) ધાર્મિક વિચાર (B) સામાજિક વિચાર (C) નૈતિક વિચાર (D) રાજકીય વિચાર
38. પુરુષનો આધારભૂત ચયાપચયી દર સ્ત્રીના ચયાપચયી દરની અપેક્ષા એ કેવો હોય છે?
- (A) ઓછો (B) અધિક (C) પ્રમાણસર (D) ખૂબ જ ઓછો
39. ભારી શ્રમ કરવાવાળી વ્યક્તિ માટે આહાર આયોજનમાં અધિક ____ વાળા ખાદ્યપદાર્થો હોવા જોઈએ?
- (A) પ્રોટીન (B) કાર્બોદિત (C) ઊર્જા (D) ગ્લુકોઝ
40. _____ એ પુખ્ત સ્ત્રીના જીવનની એક અવસ્થા છે?
- (A) ગર્ભાવસ્થા (B) કિશોરીવસ્થા (C) યુવાવસ્થા (D) વૃદ્ધાવસ્થા
41. ગર્ભ પોતાની માતા સાથે કોના દ્વારા જોડાયેલો હોય છે?
- (A) સ્નાયુઓ (B) આંતરડાં (C) નાભિ-નાળ (D) એકપણ નહિ
42. _____ એ સહજ અને સફળ ગર્ભાવસ્થાનું સૌથી સારું સૂચક છે.
- (A) શરીરમાં વૃદ્ધિ (B) સ્નાયુઓની વૃદ્ધિ (C) વજનમાં ઘટાડો (D) વજનમાં વૃદ્ધિ
43. ગર્ભ જન્મથી ત્રણ મહિના સુધી ચાલે તે માટે પ્રચુર માત્રામાં શાનો સંગ્રહ કરી રાખે છે?
- (A) પ્રોટીન (B) કાર્બોદિત પદાર્થો (C) ફોસ્ફરસ (D) લોહતત્વ
44. ગર્ભાવસ્થા દરમિયાન લોહીની માત્રા કેટલા પ્રતિશત વધી જાય છે?
- (A) 60 (B) 50 (C) 40 (D) 70
45. મધ્યમ વર્ગની ગર્ભવતી મહિલા દ્વારા પ્રતિદિન કેટલી વાર આહારની પદ્ધતિ અપનાવવાની સંભાવના રહેલી છે?
- (A) 3-4 (B) 5-6 (C) 2-3 (D) 4-5
46. સ્તનપાન અવસ્થામાં દૂધ બનાવવાની પ્રક્રિયાને ચાલુ રાખવા માટે ભોજનમાં કેવાં પદાર્થો પર્યાપ્ત માત્રામાં સંમિલિત કરવા જોઈએ?
- (A) તરલ (B) ગળ્યા (C) વિટામિન યુક્ત (D) રેસાવાળા
47. સ્તનપાન અવસ્થામાં રોજનું સરેરાશ કેટલા મિ.લી. દૂધ સ્રાવિત થાય છે?
- (A) 900 (B) 800 (C) 850 (D) 950
48. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનું ઓછામાં ઓછું કેટલા કિલોગ્રામ વજન વધવું જોઈએ?
- (A) 5 થી 6 (B) 6 થી 7 (C) 8 થી 10 (D) 7 થી 8
49. જીવનના એક થી છ વર્ષ સુધીના કાળને શું કહેવામાં આવે છે?
- (A) શાળાપૂર્વ વર્ષો (B) શૈશવ કાળ (C) બાલ્યાવસ્થા (D) એકપણ નહિ
50. જન્મ સમયે શિશુનું વજન કેટલું હોય છે?
- (A) 2.0 થી 3.0 કિ.ગ્રા. (B) 2.5 થી 3.0 કિ.ગ્રા.
(C) 3.0 થી 3.2 કિ.ગ્રા. (D) 2.8 થી 3.2 કિ.ગ્રા.

51. શિશુને “સુજીની ખીર” કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે?
 - (A) દક્ષિણ ભારત (B) ઉત્તર ભારત (C) પૂર્વ ભારત (D) પશ્ચિમ ભારત
52. કેટલા મહિનાની આયુમાં બાળક બધા નરમ આહાર ખાઈ શકે છે?
 - (A) 4 મહિના (B) 8 મહિના (C) 12 મહિના (D) 5 મહિના
53. શિશુને પૂરક આહારની સાથે સાથે શું આપવું જોઈએ?
 - (A) ઓટ્સ (B) ગાયનું દૂધ (C) ભેંસનું દૂધ (D) માતાનું દૂધ
54. વધેલી કેવી ક્રિયાઓ શાળાપૂર્વે અવસ્થાની વિશેષતા છે?
 - (A) માનસિક (B) શારીરિક (C) સાંવેગિક (D) બૌદ્ધિક
55. ત્રણ વર્ષની ઉંમર સુધીમાં બાળકની લંબાઈ લગભગ કેટલા સે.મી. હોય છે?
 - (A) 93 સે.મી. (B) 96 સે.મી. (C) 100 સે.મી. (D) 97 સે.મી.
56. શાળાપૂર્વે બાળકો વાસ્તવમાં કેવા જોવા મળે છે?
 - (A) નિષ્ક્રિય (B) સક્રિય (C) ઉત્સાહી (D) તોફાની
57. શાળા પૂર્વે અવસ્થા કેવી વૃદ્ધિનો સમય છે?
 - (A) મંદ (B) તીવ્ર (C) પ્રમાણસર (D) અંકુશિત
58. શિશુ માટે _____ સંતુલિત આહાર હોય છે.
 - (A) માનું દૂધ (B) ગાયનું દૂધ (C) રાબ (D) દાળનું પાણી
59. હિમોગ્લોબિનના નિર્માણ માટે કોની વધારે આવશ્યકતા હોય છે?
 - (A) પોટેશિયમ (B) એમિનો એસિડ (C) ઝલુકોઝ (D) લોહતત્વ
60. કેટલા વર્ષના અંત સુધી છોકરીઓનું વજન છોકરાઓથી અધિક હોય છે?
 - (A) 5 વર્ષના (B) 10 વર્ષના (C) 15 વર્ષના (D) 12 વર્ષના
61. પીરસણની માત્રાનું નિર્ધારણ બાળકની કઈ બાબતને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ?
 - (A) ખાવાની રુચિ (B) ખાવાની ટેવ (C) ખાવાની ક્ષમતા (D) ખાવાની ઇચ્છા
62. બહુ વધારે ચરબી અને ખાંડ ખાવી એ કયા રોગનું કારણ બને છે?
 - (A) ટી.બી. (B) હૃદય રોગ (C) શ્વાસના રોગો (D) કેન્સર
63. કોણ ચયાપચયના દરને નિયંત્રિત કરે છે?
 - (A) ફોલિક એસિડ (B) નિયાસીન (C) કેરોટીન (D) થાઈરોક્સીન
64. આયોડીન સૂક્ષ્મ માત્રાનું _____ છે.
 - (A) કાર્બોહિદ્રેટ (B) ખનિજ ક્ષાર (C) પ્રોટીન (D) સલ્ફર
65. જેમ જેમ સભ્યોની સંખ્યા વધે છે તેમ તેમ પ્રતિ વ્યક્તિના ભોજન પર ખર્ચ _____ જાય છે.
 - (A) વધતું (B) ઉચ્ચ (C) ઘટતું (D) પ્રમાણસર
66. પૂર્ણ પારિવારિક અંદાજપત્રમાં ત્રણ મૂળ આવશ્યકતાઓ સૌ પ્રથમ સ્થાન કોનું છે?
 - (A) આહાર (B) કપડાં (C) મકાન (D) એકપણ નહિ
67. પોષ્ટિકતાની દ્રષ્ટિએ કયું ફળ ઉત્તમ છે?
 - (A) સફરજન (B) દ્રાક્ષ (C) ચીકુ (D) પપૈયું
68. પ્રત્યેક ખાદ્યપદાર્થ મોસમમાં બીજા મોસમની અપેક્ષાએ કેવા હોય છે?
 - (A) મોંઘા (B) સસ્તા (C) પ્રમાણસર (D) વ્યાજબી

69. ઓછી આવકવાળા બે પ્રૌઢ વ્યક્તિઓ અને બે કિશોર બાળકોવાળા પરિવાર માટે લગભગ કેટલા કિલો અનાજની પ્રતિમાસ આવશ્યકતા હોઈ શકે છે?
- (A) 50 કિલો (B) 100 કિલો (C) 30 કિલો (D) 20 કિલો
70. બજારમાંથી ખરીદી કરવાની કેટલી ખરીદી સુચિઓ છે?
- (A) ત્રણ (B) બે (C) પાંચ (D) ચાર
71. _____ નો અર્થ થાય છે ખાદ્યપદાર્થને ખાવા યોગ્ય બનાવી અને તૈયાર કરવું.
- (A) ઉત્પાદન (B) સંસાધન (C) ખેતી (D) ઉપજ
72. આહાર નિયોજન કરતી વેળાએ શેના પર વધુ ભાર આપવો જોઈએ?
- (A) ખર્ચ (B) પર્યાપ્તતા (C) પૌષ્ટિકતા (D) અનિવાર્યતા
73. ભારતમાં વર્ષ 1888-89 માં ઘઉંનું કુલ ઉત્પાદન કેટલું હતું?
- (A) 54 મિલિયન ટન (B) 57 મિલિયન ટન
(C) 55 મિલિયન ટન (D) 60 મિલિયન ટન
74. પરંપરાગત મુલાયમ સફેદ ઘઉંની જાતિ કઈ છે?
- (A) શરબતી (B) બંસી (C) દારી (D) ફરસ
75. કયા વર્ષના અંતમાં ભારતમાં અધિક ઉત્પાદન તથા નાના-ટૂંકા છોડવાળા મેક્સિકન ઘઉં જેવા કે સોનારાનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો?
- (A) 1970 (B) 1960 (C) 1965 (D) 1962
76. ભારતમાં દરેક જગ્યાએ ઓછામાં ઓછા કેટલા વર્ષ જૂના ચોખા પસંદ કરવામાં આવે છે?
- (A) બે વર્ષ (B) ત્રણ વર્ષ (C) ચાર વર્ષ (D) એક વર્ષ
77. રાગી મુખ્ય રૂપે ક્યાં ઉગાડવામાં આવે છે?
- (A) ઉત્તર ભારત (B) દક્ષિણ ભારત (C) પશ્ચિમ ભારત (D) પૂર્વ ભારત
78. _____ એ ઊર્જાનું સર્વોત્તમ તથા સૌથી સસ્તું સાધન છે.
- (A) કઠોળ (B) શાકભાજી (C) અનાજ (D) ફળો
79. જ્યાં પોલિશ કરેલા ચોખા જ મુખ્ય ભોજન હોય છે ત્યાં કયો રોગ થવાની સંભાવના ઘણી વધારે રહેલી છે?
- (A) બેરી-બેરી (B) પાંડુરોગ (C) સ્કર્વી (D) ગોઈટર
80. બટાકામાં કયું વિટામિન ઘણી માત્રામાં જોવા મળે છે?
- (A) 'એ' (B) 'બી' (C) 'સી' (D) 'ડી'
81. કયું તેલ પીળાશ પડતા લાલ રંગનું હોય છે?
- (A) તલનું (B) સરસોનું (C) મગફળીનું (D) ચોખાના ભુંસાનું
82. ભારતમાં લોકો કેટલા વર્ષ પૂર્વેથી ખાંડ અને ગોળ બનાવવાની પ્રક્રિયા જાણે છે?
- (A) ઈ.સ. પૂર્વે 1200 થી (B) ઈ.સ. પૂર્વે 1500 થી
(C) ઈ.સ. પૂર્વે 1400 થી (D) ઈ.સ. પૂર્વે 1600 થી
83. પ્રવાહી ઝુકોઝમાં કેટલા પ્રતિશત પાણી હોય છે?
- (A) 10 પ્રતિશત (B) 12 પ્રતિશત (C) 15 પ્રતિશત (D) 20 પ્રતિશત
84. પાસ્ચુરિકરણની પ્રક્રિયામાં કોને નિશ્ચિત સમય માટે નિશ્ચિત તાપ પર ગરમ કરવામાં આવે છે?
- (A) દહીં (B) તેલ (C) દૂધ (D) ખાંડ

85. કેરોટીનમાં કયો રંગ જોવા મળે છે?
 (A) હલકો પીળો (B) હલકો લાલ (C) લીલો (D) સફેદ
86. કોણ પ્રોટીનનો સાંદ્રિત સ્ત્રોત છે?
 (A) ધી (B) દહીં (C) પનીર (D) માવો
87. ન્યુટ્રીટિવ વેલ્યુ ઓફ ઇન્ડિયન ફૂડ્સમાં કેટલી જાતની પાંદડાંવાળી શાકભાજીની સૂચી આપવામાં આવી છે?
 (A) 115 (B) 112 (C) 120 (D) 122
88. કયું ફળ ટોટીનનો ઘણો સારો સ્ત્રોત છે?
 (A) કેરી (B) પાઈનેપલ (C) દ્રાક્ષ (D) પપૈયું
89. કયો દેશ મસાલાના દેશ તરીકે જાણીતો છે?
 (A) શ્રીલંકા (B) ચીન (C) ભારત (D) જમ્મુ કાશ્મીર
90. યા એ કયા દેશની દેન છે?
 (A) ચીન (B) ભારત (C) રશિયા (D) જાપાન
91. બેક્ટેરિયા તથા વિસ્ટને ફૂગની અપેક્ષાએ કેવા ભેજની આવશ્યકતા હોય છે?
 (A) ઓછા (B) અધિક (C) પ્રમાણસર (D) એકપણ નહિ
92. સૂક્ષ્મજીવાણું જેને ઉછેરવા માટે હવાની આવશ્યકતા હોય છે તેને શું કહેવામાં આવે છે?
 (A) વાયુજીવી (B) જળજીવી (C) વનસ્પતિ જીવી (D) દ્રવ્યજીવી
93. બેક્ટેરિયાને વિકસતા અટકાવવા માટે ખાદ્યપદાર્થમાંથી પાણી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
 (A) પાસ્ચૂરીકરણ (B) નિર્જલીકરણ (C) હિમદ્રવણ (D) બ્લાન્ચિંગ
94. જેલી પ્રાપ્ત કરવા ફળમાં કયું તત્વ હોવું જોઈએ?
 (A) અમ્લીય (B) પેક્ટીન (C) ટેનિન (D) ઝલુકોઝ
95. અંકુરણ કરવા માટે કહોળ કે અનાજને કેટલા કલાક પલાળી રાખવામાં આવે છે?
 (A) 12 કલાક (B) 14 કલાક (C) 8 કલાક (D) 24 કલાક
96. કોણ શરીરમાં ઝલુકોઝની એક્સિડેશનની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે?
 (A) ઈન્સ્યુલિન (B) બેક્ટેરિયા (C) પ્રોટીન (D) પ્રજીવો
97. લોહીની નળીઓ કેટલી જાતની હોય છે?
 (A) ત્રણ (B) ચાર (C) બે (D) પાંચ
98. માથાનો ઘેરાવો મુખ્યત્વે કોના કદ સાથે સંબંધ ધરાવે છે?
 (A) ગળાના (B) મગજના (C) શરીરના (D) સ્નાયુઓના
99. _____ એ સંસ્થાની મોટામાં મોટી મિલકત છે.
 (A) માનવબળ (B) માનવ ખર્ચ (C) માનવઇચ્છા (D) સંસાધન
100. કરારની ભાષા સામાન્ય રીતે કેવી હોય છે?
 (A) વહીવટી (B) કાયદાકીય (C) સામાજિક (D) રાજકીય

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

‘જયોતિર્મય’ પરિસર, સરખેજ-ગાંધીનગર હાઈવે, છારોડી, અમદાવાદ-382481

સત્રાંત પરીક્ષા જાન્યુઆરી - 2026

નોંધણી નંબર :

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

(સંપૂર્ણ નોંધણી નંબર લખવો)

પાઠ્યક્રમ : _____

અભ્યાસક્રમ (અવશ્ય લખવો) : _____

અભ્યાસ કેન્દ્રનો કોડ નં. _____

પરીક્ષાની તારીખ : _____

નોંધ : (1) વિદ્યાર્થીએ સાચા ઉત્તરની સામે પેનથી 'X' નિશાની કરવી.

(2) જે વિદ્યાર્થી પોતાનો સાચો નોંધણી નંબર નહીં દર્શાવે તેનું પરિણામ રદ થશે.

દા.ત. પ્રશ્ન: 1 ગાંધીજીનો જન્મ કયારે થયો હતો ?

(1) 5મી મે(2) 10મી જુલાઈ(3) 2જી ઓક્ટોબર(4) 8મી જૂન

પ્રશ્ન ક્રમાંક	1	2	3	4
1			X	

વિદ્યાર્થીએ બારકોડ સ્ટીકર

અહીં ચોટાડવું

પ્રશ્ન ક્રમાંક	A	B	C	D	પ્રશ્ન ક્રમાંક	A	B	C	D	પ્રશ્ન ક્રમાંક	A	B	C	D	પ્રશ્ન ક્રમાંક	A	B	C	D
1					26					51					76				
2					27					52					77				
3					28					53					78				
4					29					54					79				
5					30					55					80				
6					31					56					81				
7					32					57					82				
8					33					58					83				
9					34					59					84				
10					35					60					85				
11					36					61					86				
12					37					62					87				
13					38					63					88				
14					39					64					89				
15					40					65					90				
16					41					66					91				
17					42					67					92				
18					43					68					93				
19					44					69					94				
20					45					70					95				
21					46					71					96				
22					47					72					97				
23					48					73					98				
24					49					74					99				
25					50					75					100				

વિદ્યાર્થીની સહી _____

(મૂલ્યાંકન કાર્ય માટે)

ખંડ નિરીક્ષકની સહી _____

તપાસનારની સહી : _____

મોડરેટરની સહી : _____

કુલ આપેલ જવાબ : _____

તપાસનારનું નામ : _____

મોડરેટરનું નામ : _____

ખોટા જવાબ : _____

તારીખ : _____

તારીખ : _____

કુલ માર્ક્સ : _____